



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૮/૦૩/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૪૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૪૦ વ્યક્તિઓને ઝડપી, ૧૭૮ લીટર દેશી દારૂ, ૧૭ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૦૦ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૩૯ બિયર ટીન અને ૨ મોટર સાયકલ કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૧૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૧૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૪૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૪૪૨/૧૯

રખીયાલ: રાજેન્દ્રકુમાર જેતારામ માળી (રહે.મહાદેવ મેટલ નંબર-૨ ભંડારી એસ્ટેટ દુર્ગા એસ્ટેટની નજીક કેવલકાંટા રખીયાલ) એ તા.૮/૩/૧૯ નારોજ રખીયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે ઓગસ્ટ/૨૦૧૮ ના રોજ રાજેન્દ્રકુમારની રખીયાલ કેવલકાંટા ખાતે આવેલ "મહાદેવ મેટલ" નામની ઓફિસ ખાતે આરોપી રત્નારામ નગારામ દેવાસી (રહે.દેવડા તા.રાનીપાડા જી.જાલોર સાંચોર રાજસ્થાન) એ પોતે યાદનાંમા નિકાસકાર હોય તેમ જણાવી રાજેન્દ્રકુમારને ધંધા માટે સ્ટેનલેસ સ્ટીલ પાઇપનો સામાન યાદનાથી મંગાવી આપવાનો વિશ્વાસ અપાવી, યાદના કંપનીનું ડેક ઇન્સ્ટ્રીઝ લિમિટેડના એકાઉન્ટમાં કુલ રૂપિયા ૮,૨૫,૨૨૩/- રાજેન્દ્રકુમારના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરાવ્યા બાદ માલસામાન નહીં મંગાવી રાજેન્દ્રકુમાર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.આઇ.પટેલ ચલાવે છે.

પગમાં કઈક કરડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૪૪૩/૧૯

નરોડા: તા.૦૭/૦૩/૧૯ સાજના ૫/૩૦ વાગ્યાના સુમારે વલ્સનરાજન સ/ઓ ગોવિંદભાઈ (ઉ.વ.૫૪) (રહે. સ્વામિનારાયણ પાર્ક હરિદર્શન ચાર રસ્તા પાસે નરોડા) નાઓને ડાબા પગે કઈક કરડી જતા સારવાર માટે તેમને સેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ૬/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી યોગેશભાઈ નારાયણભાઈ ચલાવે છે.

લાશ મળી આવવા બાબત:-

સમાચાર યાદી નં.૪૪૪/૧૯

બાપુનગર: તા.૦૮/૦૩/૧૯ બપોરના ૪/૪૫ વાગ્યાના સુમારે શક્તિ ચેમ્બરના ભોયરામાંથી સડી ગયેલી હાલતમાં સંજયકુમાર જીવણલાલ ભાવસાર (ઉ.વ.૪૮) (રહે.તપોવન સોસાયટી વિભાગ-૧ અનિલ સ્ટાર્ચ મીલ રોડ સરસપુર) નાઓની લાશ મળી આવતા આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી બી.ડી.રાઠોડ ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૪૪૫/૧૯

રામોલ: સમજબહેન વા/ઓ શામજીભાઈ વાળા (ઉ.વ.૮૦) (રહે. સુદામા ફલેટ વિજય ગોલ્ડના ખાંચામા સુરેલીયા વસ્ત્રાલ) તા.૭/૩/૧૯ સવારના ૯/૦૦ વાગ્યાના સુમારે દીવાબત્તી કરતા હતા ત્યારે સળગતી દીવાસળી સાડીને અડી જતા આગ લાગતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સાજના ૭/૧૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ઓ.ભરવાડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૪૪૬/૧૯

જીઆઈડીસી વટવા: જીઆઈડીસી વટવા શર્મા ફાઇન પર ફોરેટર્સ પ્રા.લી. પ્લોટ નં ૯૧/૪૬૦૭ ફેઝ-૪ ખાતે કંપનીના રૂમમાં રહેતા અને ત્યા જ કામ કરતા ચંદ્રભાન બાબુલાલ સૈની (ઉ.વ.૨૩) એ અગમ્ય કારણસર તા.૮/૩/૧૯ સાજના ૫/૩૦ વાગ્યાના સુમારે પોતાના રહેણાંકમાં ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.સી.જાડેજા ચલાવે છે.

ઇસનપુર: જય સુરેશભાઈ પટેલ (ઉ.વ.૨૫) (રહે. મોતીબાગ સોસાયટી ભાડુઆતનગર ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૮/૩/૧૯ કલાક ૭/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.